Shrenik Limited Chin: L51396GJ2012PLC073061 Registered Office: 505-508, TEN/11, Beside Mardia Plaza, C.G. Road, Nhmedabad - 380 009, Gujarat. Tel.: (079) 26440303 Telefax: (079) 26406810 Email: cs@shrenik.co.in Website: www.shrenik.co.in tract of the Statement of the Unaudited Financial Results for the quarter and half year ended 30 <sup>th</sup> September, 2020 (Rs. In Lakhs)	बैंक ऑफ़ इंडिया <b>Bank of India</b>	BOI STAR MEGA E-AUCTION FOR SALE OF	PROPERTIES UNDER S	<b>ZONAL OFF</b> Ellorapark, Sub Ph.: (0265) 23	bhanpui 96573	a,Vado	dara - 3	
Particulars         Quarter ended 30 <sup>th</sup> September, 2020         Quarter ended 30 <sup>th</sup> September, 2020         Quarter ended 30 <sup>th</sup> September, 2020         Half year ended 2019         Half year ended 2020           Total Income from Operations         17616.06         22521.13         23494.21           Net Profit / (Loss) for the period	hereby given to the public in gener the Authorized Officer of Bank of Ir from the respective Borrower(s) a	nmovable assets under the securitization and reconstruction of financial assets and enf al and in particular to the following Borrower(S) & Guarantors(S) that the below describe dia will be sold on " AS IS WHERE IS BASIS"," AS IS WHAT IS BASIS" AND "WHATEVER T d Guarantor(s).The reserve price and the earnest money deposit is shown there against e	forcement of security interest act, 2002 read with ed immovable properties mortgaged/charged to B 'HERE IS BASIS'' for recovery of respective dues a each secured asset. The sale will be done by the u	provision to Rule 8(6) of the S lank of India (secured creditor), s detailed hereunder against the Idersigned through e-auction pl	Security Inter , the physica e secured ass latform provi	possession ets mortgag ded hereunde	of which has ed/charged to	been taken
(before Tax, Exceptional and/or Extraordinary items)     340.73     521.80     159.87       Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)     340.73     521.80     159.87       Net Profit / (Loss) for the period     340.73     521.80     159.87	Sr. Name of the No. Borrower/ Guarantor/ Owner/ Partner/ Mortgagor of the property	AND TIME OF AUCTION: 21-11-2020 between 11.00 am to 01.00 Details of Banks dues as per Notices*	Lot No. Details of Property to	) be Sold	Minimum Reserve Price (Rs. in Lac)	EMD (Rs. in Lac)	Date/Time of E-Auction	Possession
after tax (after Exceptional and/or Extraordinary items)     302.33     388.84     121.25       Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other     4     4	GHOD DOD ROAD F M/s. Tempines Exim Proprietor: Mr. Kushan Dosalal Shah	<b>BRANCH, 4, BOI Complex, Opp. Panjara Pole, Ghod Dod Road,</b> As per Notice U/S 13(2) Dated 01-01-2019 <b>Rs. 2,58,74,891.09</b> (Rupees Two Crore Fifty Eight Lacs Seventy Four Thousand Eight Hundred Ninety One & Nine Paise Only) plus further interest and cost incidental expenses etc minus recovery if any	1 Plot No. 93, Block No. 258/1 admeasuri	ng 139.00 sq.mtrs. Paiki 01,	<b>ile : 950′</b> Rs. 14.83	<b>1 17273</b> Rs. 1.48	/ <b>98260 4</b> 21/11/2020 11 AM to 1 PM	1175 Physical
Comprehensive Income (after tax)]     309.81     388.66     128.08       Equity Share Capital     2040     2040     2040       Earnings Per Share (of Rs. 2/- each) for continuing and discontinued     6     6	Guarantor: Mr. Kutarth Dosalal Shah		<ul> <li>Plot No. 20, Block No. 258/1 admeasuri Desire Valley-1, B/h. Khushal Wadi G Chhapra, Ta : Navsari, Dist : Navsari.</li> </ul>	ig rooioo oqintaoi rana or,	Rs. 20.60	Rs. 2.06	21/11/2020 11 AM to 1 PM	Physical
berations) - Basic: 0.30 0.38 0.12 Diluted: 0.30 0.38 0.12			3 Plot No. 19, Block No. 258/1 admeasuri Desire Valley-1, B/h. Khushal Wadi G Chhapra, Ta : Navsari, Dist : Navsari.	ali, Chhapra Village Road,	Rs. 20.83	Rs. 2.08	21/11/2020 11 AM to 1 PM	Physical
ove is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter f year ended on 30 <sup>th</sup> September, 2020 filed with the Stock Exchange under Regulation ne SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The mat of the Unaudited Financial Results for the quarter and half year ended on			4 Plot No. 18, Block No. 258/1 admeasuri Desire Valley-1, B/h. Khushal Wadi G Chhapra, Ta : Navsari, Dist : Navsari.	ali, Chhapra Village Road,	Rs. 20.78	Rs. 2.08	21/11/2020 11 AM to 1 PM	
tember, 2020 is available on the website of National Stock Exchange of India i.e. <u>eindia.com</u> and on the website of the Company i.e. <u>www.shrenik.co.in</u> . For and on behalf of the Board of Directors Ahmedabad Shrenik Vimawala	2 M/s. Enigma Blue Overseas Mrs. Sweety Sanjay Juneja	As per Notice U/S 13(2) Dt. 27.07.2017 <b>Rs. 4,89,00,000.00</b> (Rupees Four crore eighty nine lacs only) plus further interest and Cost incidental expenses etc minus recovery if any	Tower)         Ghoddod         Rd         having         carpe           2.         Residential         Flat         No         502, 5         (B)         Rangeel	t area of 1235.12 sq.ft a Park, Tower No. 04 (King		Rs. 5.65 Rs. 5.65	21/11/2020 11 AM to 1 PM 21/11/2020	Physical Physical
17.10.2020 Chairman and Managing Director	Mr. Sanjay Ramjidas Juneja Mr. Rajesh Chandrakant Shidore Mrs. Chandrkant C. Shidore Mrs. Manisha K. Poojari		Tower)         Ghoddod         Rd         having         carpe           3.         Office No. J/724, 7th         Floor, Japan Market         up area of 527 sq.ft.		Rs. 25.75	Rs. 2.58	11 AM to 1 PM 21/11/2020 11 AM to 1 PM	Physical
Bank O 3GR201 OF         States           Windford         Windford         Common Centre, Sardar Patel Bhavan, Junagarh – 362 001           Windford         Composition         Tel No. 0285-2627800; Email: Bm2627@andhrabank.co.in           ICE UNDER SECTION 13(2) OF ACT 54 OF 2002 FOR         Common Centre	Mrs Seema Sachin Subandh	BRANCH, Opp. Maskati Hospital, P.O.Box. No. 25, Stat	tion Road, Surat - 395003. Pho	ne : 0261-2401191/	(92/93 M	obile : 9	7243 39	731
ENFORCEMENT OF SECURITY INTEREST DEMAND NOTICE 27/Recovery/18 Date: 06-10-2020 tor / Mortgagors iodarbhai Pragjibhai Gosia	<ul> <li>3 M/s. Yeshraj Textiles Proprietor: Mr. Yogesh Hasmukhbhai Patel Mr. Haresh Ganpatbhai Dudhat</li> </ul>	As per Notice U/S 13(2) Dated 12-06-2017 <b>Rs. 2,03,47,426.18</b> (Rupees Two Crore Three Lacs Forty Seven Thousand Four Hundred Twenty Six & Eighteen Paise Only) plus further interest and cost incidental expenses etc minus recovery if any	Commercial property with civil structure ( 2, R. S. No. 169/2 & 190 Block No. 251 F Office Karanj, Taluka Mandvi, Surat Plot Ar	aiki, Behind Gram Panchayat	Rs. 103.08	Rs. 10.31	21/11/2020 11 AM to 1 PM	1 1
<ul> <li>5 01. 79, Bundar Vistar Mangrol Junagadh-362225 Address 02. R.S.NO. 11931193/3</li> <li>4 Plot No 13 &amp; 14 Bai Area Kharva Road Mangrol Bandar Muktupur Road, Mangrol Dist. Ih. am,</li> <li>5: Enforcement of Security Interest Action Notice13(2) OF ACT 54 OF 2002 In connection with the credit facilities enjoyed By M/s Mukesh Dama Sukhadiya Prop.</li> </ul>	4 <b>M/s. Patel Corporation</b> Mr. Vipulbhai Balubhai Patel	further interest and cost incidental expenses etc minus recovery if any	Plot No. 107 & 108, Opp. Balaji Bunglow Surat.	5. 306 & 307 T.P. No. 68, Final s, Mouje Puna, Taluka Puna,	Rs. 89.60	Rs.8.96	21/11/2020 11 AM to 1 PM	Physical
Mr. Mukesh Dama Sukhadiya with our Junagadh Branch.         tesh Dama Sukhadiya Prop. Mr. Mukesh Dama Sukhadiya have availed the following illities from our Junagadh Branch.         Limit       Amount (in Rs.)         Nature       Amount (in Rs.)         SODGN       Rs.79,00,000.00/-         TLOEI       Rs.1,86,000.00/-         Wyment of dues to the Bank in the above facilities was duly guaranteed by you by executing a	5 Mr. Rameshbhai Keshubhai Borad Mr. Mukeshbhai Keshubhai Borad Mr. Jignesh Kantibhai Barvaliya	URAT (MAIN) BRANCH, Lalgate, Surat - 395003. F As per Notice U/S 13(2) Dated 09-08-2018 Rs. 24,77,867.00 (Rupees Twenty Four Lac Seventy Seven Thousand Eight Hundred Sixty Seven only) plus further interest and cost incidental expenses etc minus recovery if any.	Residential House Situated at Plot No. 21 B/s. Enjoy Farm, Vav to Jokha Gam	2, "Shree Shubh Residency" Road, Moje Jokha bearing	97243 3 Rs. 25.73	9 <b>704</b> Rs.2.57	21/11/2020 11 AM to 1 PM	Physical
f guarantee. You have further created an Equitable Mortgage of the following property as isecurity for the above advance availed by M/s Mukesh Dama Sukhadiya Prop. Mr. Mukesh ukhadiya. we advance were availed by the said borrower M/s Mukesh Dama Sukhadiya Prop. Mr. Dama Sukhadiya, and were classified as NPA account w.e.f01.06.2019 Pursuant to default in epayment of dues / interest. As of 30.09.2020, a sum of Rs.86, 11,586.02 (Rupees Eighty Six sven Thousand Five Hundred Eighty Six and Two paisa only)) is outstanding in the account	6 Mr. Milankumar Kantilal Gajera & Mr. Ravin Kantilal Gajera.	As per Notice U/S 13(2) Dated 05-12-2018 <b>Rs. 28,17,594.00</b> (Rupees Twenty Eight Lac Seventeen Thousand Five Hundred Ninty Four only) plus further interest and cost incidental expenses etc minus recovery if any.	Residential Row House Situated on Plot N Jokha Gam Road, Moje Jokha I Block No. 204, "Shree Shubh Residency" Area : 66.86 Sq.mt. with undivided comm	earing RS No. 192/2, Ta:Kamrej, Dist:Surat, Plot	Rs. 24.65	Rs.2.47	21/11/2020 11 AM to 1 PM	Physical
below: -         Amount O/s (in Rs.)           Limit         Amount O/s (in Rs.)           SODGN         Rs.79,00,000.00/-           Rs.1,84,603.00         Rs.1,84,603.00           of our repeated demands neither the borrower M/s Mukesh Dama Sukhadiya Prop. Mr.         Sukhadiya Prop. Mr.	7 <b>M/s. Tisha Fabrics</b> Proprietor Mr. Rajubhai Manjibhai Bhalani <b>Guarantor:</b> Mr. Saniay Girdharbhai	As per Notice U/S 13(2) Dt. 11.01.2017 <b>Rs. 2,43,02,663.56</b> (Rupees TWo Crore Forty Three Lacs Two Thousand Six Hundred Sixty Three & Fifty Six Paise Only) plus further interest and Cost incidental expenses etc minus recovery if any	1. Commercial Property Situated at Block N 125 & 126) "Shivdhara Raschel Park", F Power Station, Opp. Gaypagla Temple, Ta : Kamrej, Dist : Surat, Plot Area: 308.5 334.82 sq.mt.	lot No. 81 & 82, Nr. Torrent N.H.No. 08, Dhoran Pardi,	Rs. 60.00	Rs. 6.00	21/11/2020 11 AM to 1 PM	Physical
Dama Sukhadiya, nor you have paid any amount towards the amount outstanding in the and you have not discharged the liabilities. erefore to call upon you in terms of section 13(2) of the Securitisation and Reconstruction of Assets and Enforcement of Security Interest Act, 2002 to pay a sum of <b>Rs.86, 11,586.02</b> Eighty Six Lakh Eleven Thousand Five Hundred Eighty Six and Two paisa only))	Ranpariya Mr. Ashish Chhaganbhai Lathiya		2. Machinery used in Knitting installed at the		Rs. 69.05	Rs. 6.91	21/11/2020 11 AM to 1 PM	Physical
with contractual rate of interest from 30.09.2020 with monthly rest/as per the terms and so floan documents executed by you and discharge your liabilities in full within 60 days from of receipt of this notice, failing which, we shall be constrained to enforce the following security by you in favour of the bank by exercising any or all of the rights given under the said Act : <b>PTION OF THE SECURED ASSET:</b> <b>titial Land:</b> - Residential open plot belonging to Mr. Damodarbhai Pragjibhai Gosia Situated in 1193/3 & 1193/4, plot No 13 & 14, Bai Area, Kharva Road, Mangrol Bandar, Muktupur Road, Joist Junagadh admeasuring 208 sq. mtr and <b>bounded by East</b> : S. No. 1193/1, <b>West</b> - Plot	8 Mrs. M.K. IMPEX Anjani Shyamratan Kedia Mrs. Abhadevi Shyamratan Kedia	As per Notice U/S 13(2) Dt. 27.04.2016 <b>Rs. 1,84,81,123.00</b> (Rupees One Crore Eighty Four Lacs Eighty One Thousand One Hundred Twenty Three Only) plus further interest and Cost incidental expenses etc minus recovery if any BRANCH, Ward No. 17-A, 154, Agyari Street, Ada	Krupa Society, Plot No. 19, Opp. Atul Colc Valsad Built-up Area : 1957.46 Sq. Ft	ny, Parnera, Ta. Valsad, Dist :	Rs. 69.10	Rs. 6.91	21/11/2020 11 AM to 1 PM	Physical
North:- Piot no 6 & 7. South:- 6.00 Mtr Road. se note that if you fail to remit the dues within 60 days and if Bank exercises all its rights under and if the dues are not fully asilified with the sale proceeds of the secured assets, we shall be ned to take appropriate legal action against you in a court of law/Debt Recovery Tribunal for of the balance amount from you. are requested to note that as per section 13 (13) of the Act, on receipt of this notice you are ad /prevented from disposing of or dealing with the above securities except in the usual course sess without the consent of the bank. Please also note that any violation of this section entails consequences.	9 Mr. Devendra Ravjibhai Parmar Guarantor : Mr. Ayaskanta Akshaykumar Mishra.	As per Notice U/S 13(2) Dated 19-06-2017 <b>Rs. 12,04,936.00</b> (Rupees Twelve Lac Four Thousand Nine Hundrred Thirty Six only) plus further interest and cost incidental expenses etc minus recovery if any.	Flat No. A/2-403, Vishwas Flats, Nr. S	ilver Park Society, Palanpur No. 298/1/A, T.P. No. 13,	Rs. 14.70	Rs.1.47	21/11/2020 11 AM to 1 PM	Physical
kind attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act in of time available, to redeem the secured assets <b>Authorized Officer</b> <b>Junagadh Union Bank of India</b>	10 M/s. Srhee Ram Cotton	BRANCH, Dhokalia, Post Office Bodeli, Dis As per Notice U/S 13 (2) Dt. 13.07.2017 Rs. 6,90,67,000.00 (Rupees Six Crore	1. Ginning & Pressing Factory Land with s	ned,office,rest room,store &			<b>43 397</b> 21/11/2020	28 Physical
	Shri Chandrakant Natvarlal Shah Shri Miteshkumar	Nintey Lacs Sixty Seven Thousand Only.) plus further interest and cost incidental expenses etc. minus recovery if any	other untillites at parvata (Kaledia) Ta. Sa Area of land :19829.66 sq.mts           2.         Machinery as situated above place		Rs.47.00	Rs. 4.70	11 AM to 1 PM 21/11/2020	Physical
Bank () रुजियन लेड मानग के कार्यने प्रान्तमा के Sardar Patel Bhavan, Junagarh – 362 001 Tel No. 0285-2627800; Email: Bm2627@andhrabank.co.in	Chandrakant Shah		3.         Residential House no 4/81 at kaledia Udepur,Area of Plot: 60.50 Sq.mts & build	, la ballinoua, Biotionnota	Rs.8.00	Rs. 0.80	11 AM to 1 PM 21/11/2020 11 AM to 1 PM	Physical
TICE UNDER SECTION 13(2) OF ACT 54 OF 2002 FOR ENFORCEMENT OF SECURITY INTEREST DEMAND NOTICE		1st Floor, above Dhaval Flootranics, Own, Badar Colomy, Modasa	4. Residential house no.4/80 at kaledia Udepur,Area of Plot: 70.19 Sq.mts & build	up area is 109.20 sq.mts.		Rs. 0.80	21/11/2020 11 AM to 1 PM	Physical
S27/Recovery/17     Date: 06-10-2020       kesh Dama Sukhadiya Prop. Mr. Mukesh Dama Sukhadiya     s       s 01. On Bai Matupur Road, Bandar, Mangrol, 362225. Address 02. R.S. NO. 1193/3 & Plot No. Bai Area, Kharva Road Mangrol Dist. Junagadh-362225       am,       B: Enforcement of Security Interest Action Notice -13(2) OF ACT 54 OF 2002 In connection with the credit facilities enjoyed By you withus - Classified as NPA	11 M/s. Bhagwati Process House Mr. Mafatbhai Muganlal Patel Mr. Ashokkumar Parshotta Patel	<b>1st Floor, above Dhaval Electronics, Opp. Badar Colony, Modasa</b> As per Notice U/S 13(2) Dated 05-07-2017 <b>Rs. 1,03,31,785.61</b> (Rupees One Crore Three Lac Thirty One Thousand Seven Hundred Eighty Five and Paise Sixty One Only) plus further interest and cost incidental expenses etc minus recovery if any m		. 177 paiki 18 Property No.	Rs. 38.14	Rs.3.81	21/11/2020 11 AM to 1 PM	Physical
connection with the credit facilities enjoyed By you withus –Classified as NPA we to inform you that your account/accounts 2627311000000052 and 262730100005765 has have been classified as NPA account AS ON 01.06.2019 pursuant to your default in making ment of dues/instalment/interest. As on 30.09.2020 date a sum of Rs.86, 11,586.02 (Rupees Six Lakh Eleven Thousand Five Hundred Eighty Six and Two paisa only) is outstanding	ALKAPURI BRA	NCH, NEAR GEB Gautam Nagar, R C Dutt Road, Alka As per Notice U/S 13(2) Dated 01-09-2018 Rs. 1,00,45,216.00 (Rupees One Crore	Flat No. B-801, 8th Floor, Tower-B, Velani	Heights, Nr. Pramukh Swami				
account/accounts as shown below         Limit         Nature       Amount (in Rs.)         SDDGN       Rs.79,00,000.00/-         TLOEI       Rs.1,86,000.00/-         Rs.1,86,000.00/-       Rs.1,84,26,983.02/-         Rs.1,86,000.00/-       Rs.1,84,603.00         amount : Rs.86, 11,586.02 (Rupees Eighty Six Lakh Eleven Thousand Five Hundred         Six and Two paisa only)) (Inclusive of interest debited up to 30.09.2020)         e of our repeated demands you have not paid any amount towards the amount outstanding in	Terms & Conditions of E-Auction 1. E-Auction is being held on a: 2. For downloading further def a.) https://www.bankofindia	Forty Five Thousand Two Hundred Sixteen only) plus further interest and cost incidental expenses etc minus recovery if any easurement of above property/ies however be verified by the bio are as under: s where is basis", as is what is basis" and "whatever there is basis" and will be conducted alls, Process Compliance and Terms & Conditions, Please visit: .co.in	Hospital, Sun Pharma Road, Atladra, Vad Sq.ft. Super Built up Area : 3759 Sq.ft dders at site and also from the rever	odara. Carpet Area : 2357.13	rticipatin	j in auctio	11 AM to 1 PM	
ccount/accounts / you have not discharged your liabilities. b hereby call upon you in terms of securin 13(2) of the Securitisation and Reconstruction of cial Assets and enforcement of Security Interest Act, 2002, to pay a sum of <b>Rs.86, 11,586.02/</b> - ier with interest at the rate of 9.75 %, p.a. with monthly rest/as per the terms and conditions of locuments executed by you anddischarge your liabilities in full within 60 days from the date of t of this notice, failing which, we shall be constrained to enforce the following securities created in favour of the bank by exercising any or all of the rights given under the said Act. <b>RIPTION OF THE SECURED ASSETS:</b> <b>ypothecation of Stocks &amp; Book Debts</b> M/s Mukesh Dama Sukhadiya Prop. Mr. Mukesh Dama adiya On Bai Matupur Road Bandar, Mangrol, -362225. <b>and and Building</b> – Residential Building belonging to Mr. Mukesh Dama Sukhadiya situated in Io, 1193/3 & 1193/4, Plot No. 4, Bai Area, Kharva Road, Mangrol Bandar, Mukutupur Road,	complete following formalit Step 1: Bidder/Purchaser Registr Step 2: KYC Verification: Bidder to Step 3: Transfer of EMD amount Step 4: Bidding Process and Auc 3. To the best of knowledge and auction and claims/ rights/c with all the existing and futur after submission of the onlir	-Auctions Service Provider- https://www.mstcecommerce.com/auctionhome/lbapi/inde ies well in Advance: ation: Bidder to register on e-Auction Platform (link given above) using his mobile number o upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service p o Bidder Global EMD Wallet: Online/off-line transfer of fund using NEFT/Transfer, using ch ion Results: Interested Registered bidders can bid online on e-Auction Platform after com information of the Authorized Officer, there is no encumbrance on the property/les. Howe ues/affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement doe e encumbrances whether known or unknown to the bank. The Authorized Officer/ Secure ue bid regarding property/les put for sale. 20 from 11.00 a.m. to 4.00 pm with prior appointment with above mentioned respective	er and email-id provider (may take 2 working days). nallan generated on e-Auction Platform. npleting Step 1, 2 and 3. Please note that Step 1 to ever, the intending bidders should make their own es not constitute and will not be deemed to constit ed Creditor shall not be responsible in any way for a	Step 3 should be completed by I ndependent inquiries regarding ute any commitment or any repr ny third party claims/ rights! du	bidder well ir 1 the encumb resentation o	advance, be rances, title o f the bank. T	fore e-Auctior f property 'he property	ndate. /les put is being :

	10	Union Bank of India				Place : Jun
		shri Talkies Road, Kotecha Patel Bhavan, Junagarh – 362 001 Email: Bm2607@andbrahank.co.in	r Pat	Comm Centre, Sarda	nk ග	. आन्धा
		Email: Bm2627@andhrabank.co.in	AC	ION 13(2) OF	E UNDER SECT	<b>O</b> Andhra
				MAND NOTI	ENFORCEMEN DE	
LU		Date: 06-10-2020			Recovery/17	Ref: 2627/R
N   H   N	11	5. Address 02. R.S. NO. 1193/3 &	25. <b>A</b>	Bandar, Mangrol,-36222	Dama Sukhadiya Prop. I . On Bai Matupur Road, Io. Bai Area, Kharva Road	M/s Mukesh Address 01.
P		an 12(2) OF ACT 54 OF 2002 In	i	v Interest Action Nati	-	Sir/Madam,
P		ce -13(2) OF ACT 54 OF 2002 In you withus –Classified as NPA	youv	it facilities enjoyed By	connection with the cred	c
1		000052 and 262730100005765 has 9 pursuant to your default in making				
2 N V	12	a sum of Rs.86, 11,586.02 (Rupees and Two paisa only)) is outstanding		ive Hundred Eighty Six		Eighty Six L
						Lim
_		Amount O/c (in Rc)	۸.	Amount (in Re.)		
E-, Fo a.) b.)	Term 1. 2.	nt towards the amount outstanding in Securitisation and Reconstruction of	F F F F F F F F F F F F F F F F F F F	usive of interest debited u have not paid any amou ischarged your liabilities. of section 13(2) of the	nt: Rs.86, 11,586.02 (R nd Two paisa only)) (Inclu Ir repeated demands you t/accounts / you have not d by call upon you in terms	SOI Total amour Eighty Six ar In spite of ou your account We do hereb
E-, Fo a.) b.) cc 2: 2: 3: 4: Tot au with aft Da Bio Bio Bio Bio Bio Bio Bio Bio Bio Bio	1. 2. Step Step 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15.	Rs.84,26,983.02/- Rs.1,84,603.00 1 Eleven Thousand Five Hundred to 30.09,2020) at towards the amount outstanding in Securitisation and Reconstruction of 1, to pay a sum of Rs.86, 11,568.02/- stas per the terms and conditions of in full within 60 days from the date of force the following securities created given under the said Act. a Sukhadiya Prop. Mr. Mukesh Dama Mukesh Dama Sukhadiya situated in 4, Mangrol Bandar, Mukturn Road, up area 157.60 Sq.Mtr and bounded .00 Mtr Road. Mukesh Dama Sukhadiya Situated in ad, Mangrol, Dist. Junagadh Land unded by East:- Road, West:- Other ng belonging to Mr. Mukesh Dama & SBI, Bandar Road, Mangrol, Dist. Sq. Mtr and bounded by East:- Road, di fBank exercises all its rights under zeeds of the secured assets, we shall court of law/Debt Recovery Tribunal u are restrained from disposing of or business without the consent of the nequences.	F F F F F F F F F F F F F F F F F F F	Rs.79,00,000.00/- Rs.1,86,000.00/- upees Eighty Six Lakl sive of interest debited u have not paid any amou ischarged your liabilities. of section 13(2) of the ecurity Interest Act, 2000 5 % p.a. with monthly re discharge your liabilities shall be constrained to er ng any or all of the rights SSETS: Debts M/s Mukesh Dar ar, Mangrol, -362225. 3uilding belonging to Mr. Bei Area, Kharva Roa uring 104.60 sq. mtr Buil Dther Property, South:- 6 Building belonging to Mr. Office & SBI, Bandar RC ea 49,16 Sq.Mtr and bor h:- Other Property, ial & Residential Buildi ear Kharva Samaj Office i, mtr Built up area 49.16 froperty, South:-Road. he dues within 60 days al sifted with the sale of pro al action against you in a nyou. receipt of this notice yo ept in the usual course o	DGN DEI nt : Rs.86, 11,586.02 (R nd Two paisa only)) (Incl. Ir repeated demands you Vaccounts / you have not d by call upon you in terms sets and enforcement of S in interest at the rate of 9.7 ents executed by you and s notice, failing which, we e our of the bank by exercisis ON OF THE SECURED As section of Stocks & Book In Bai Matupur Road Band d Building – Residential I 33/3 & 1193/4. Plot No. 4 t. Junagadh Land admeas tNo. 5, West: -3, North: - ( d Building – Residential I 9, Near. Kharva Samaj ( 9, Near, Start Satt), South d Building – Commerc tuated in R S No.3608, N and admeasuring 28.74 sq Property, North: - Other Property, South do take appropriate legg of the balance amount from ec. 13 (13) of the Act, on the above securities exce e note any violation of this	SOI TLC Total amour Eighty Six ar In spite of ou your account. We do hereb Financial Ass together with loan docume receipt of this by you in favo DESCRIPTIC 01. Hypothe Sukhadiya O 02. Land an RS No. 3109 JU. Hypothe Sukhadiya Si Junagadh La West:-Other West:-Other this Act and if be constraine for recovery C (2) As per ss dealing with Bank. Please Sink Please for account of the second secon
E-FC a.) b.) cco 2: 2: 2: 2: 2: 2: 2: 2: 2: 2: 2: 2: 2:	1. 2. Step Step 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14.	Rs.84,26,983.02/- Rs.1,84,603.00 Televen Thousand Five Hundred p to 30.09,2020) to accept the amount outstanding in Securitisation and Reconstruction of , to pay as um of Rs.86, 11,586.02/- st/as per the terms and conditions of in full within 60 days from the date of iforce the following securities created given under the said Act. a Sukhadiya Prop. Mr. Mukesh Dama Mukesh Dama Sukhadiya situated in d, Mangrol Bandar, Muktupur Road, up area 157.60 Sq.Mtr and bounded .00 Mtr Road. Wukesh Dama Sukhadiya Situated in ad, Mangrol, Dist. Junagadh Land unded by East:- Road, West:- Other ng belonging to Mr. Mukesh Dama & SBI, Bandar Road, Mangrol, Dist. Sq. Mtr and bounded by East:- Road, di fBank exercises all its rights under zeeds of the secured assets, we shall court of law/Debt Recovery Tribunal are restrained from disposing of or business without the consent of the	F F F F F F F F F F F F F F F F F F F	Rs.79,00,000.00/- Rs.1,86,000.00/- upees Eighty Six Lakl sive of interest debited u have not paid any amou ischarged your liabilities, of section 13(2) of the ecurity Interest Act, 200 5 % p.a. with monthly re discharge your liabilities shall be constrained to er ng any or all of the rights SSETS: Dobts M/s Mukesh Darr ar, Mangrol,-362225. Building belonging to Mr. , Bai Area, Kharva Roa uring 104.60 sq. mtr Buil Dther Property, South:-6 Building belonging to Mr. , Bai Area, Kharva Roa uring 104.60 sq. mtr Buil Dther Property, South:-6 Building belonging to Mr. , Bai Area, Kharva Roa auring 104.60 sq. mtr Buil Dther Property, South:-6 Building belonging to Mr. Difice & SBI, Bandar Rc ea 49.16 Sq.Mtr and bon h:- Other Property. cal & Residential Buildi ear Kharva Samaj Office , mtr Built up area 49.16 Property, South:-Road. he dues within 60 days a isfied with the sale of pro al action against you in a nyou. receipt of this notice yo opt in the usual course o section entails serious cc	DGN DEI Tt: Rs.86, 11,586.02 (R nd Two paisa only)) (Inclu trepeated demands you Vaccounts / you have not d by call upon you in terms sets and enforcement of S interest at the rate of 9.7 ints executed by you and s notice, failing which, we bour of the bank by exercisi ON OF THE SECURED AS decition of Stocks & Book in Bai Matupur Road Band d Building – Residential I 93/3 & 1193/4, Plot No. 4 t. Junagadh Land admeasa tNo.5, West:-3, North:-0 d Building – Residential I 9, Near. Kharva Samaj C g 49.16 sq. mtr Built up ar rth:-Other Property, South nd Building – Commerci tituated in R S No.3608, N and admeasuring 28.74 sq Property, North:-0 ther F hote that if you fail to remit tf the dues are not fully sati et take appropriate legg of the balance amount from tec.13 (13) of the Act, on the above securities exce e note any violation of this d attention is invited to pre	SOI TLC Total amour Eighty Six ar In spite of ou your account. We do herebe Financial Ass together with Ioan docume receipt of this by you in favo DESCRIPTIC DI Hypothe Sukhadiya OI O2. Land and RS No. 3600 Admeasuring Property, Noi O4. Land and Sukhadiya Si Junagadh La West:- Other (1) Pleasen Hithis Act and iff be constrained for recovery co (2) As per si dealing with in Bank. Please (3) Your kinc

- of linspection 04.11.2020 from 11.00 arms to 4.00 pm with prior appointment with above mentioned respective branches on the contact numbers given against respective branches. shall be submitted through online procedure only. Yes shall be deemed to have read & understood the terms & conditions of sale & be bound by them. Id price to be submitted through online procedure only. If price to be submitted through online procedure only. If price to be submitted through online procedure only. If price to be submitted through online procedure only. If price to be submitted through online procedure only. If price to be submitted through online procedure only. If the responsibility of the interested bidders to inspect and satisfy themselves about the property before submission of the bid. Tarnest Money Deposit (EMD) of the successful bidder shall be retained to wards part sale consideration and the EMD of unsuccessful bidders thall be retained. Tarnest Money Deposit (EMD) of the successful bidder shall be retained to wards part sale consideration and the EMD of unsuccessful bidder would entail forfeiture of the whole money, already deposited and property shall be put to re-auction and the defaulting er shall have no claim/right in respect of property/ amount. If the Authorized Officer/Bank nor e-Auction service provider will be held responsible for any Internet Network problem/Power failure/ any other technical lapses/failure etc. In order to ward-off such contingent situation the interested bidders a r e ested to ensure that they are technically well equipped with adequate power back-up etc. for successfully part trippating in the e-Auction event. Jurchaser shall bear the applicable stamp duties Registration fey other charges, etc. and also all the statutory (non-statutory unstatutory unstatutory unstatutory unstatutory dust eadings at any stage without assigning any reason there for. Sate Certificate will be issued in the name of the purchaser(s)/ applicant (s) only and will not be issued in any other n

 $\mathbf{O}$ 

Authorized Officer	Date: 17-10-2020	Authorized Officer
Union Bank of India	Place : Vadodara.	BANK OF INDIA

આગામી

PTC India

Place: New Delhi Date: 17/10/2020

સ્ટ્રક્શન યોરીટી

થોડાક

PTC India Ltd. Regd. Office : 2nd Floor, NBCC Tower, 15, Bhikaji Cama Place, New Delhi - 110 066 (CIN : L40105DL1999PLC099328) કુંપનીઓએ વાહનોની નિયમિત

પહેરવા સહિતના અનેક પગલાની

## ઓલા પુનામાં નવું ટેક સેન્ટર સ્થાપી ૧૦૦૦ એન્જીનીયરોની ભરતી કરશે સુનિશ્ચિત કરવા બંને રાઈડ હેઈલિંગ

∆ इताहाबाद

થશે. ગત વર્ષે જૂનમાં સેન ક્રાન્સિસકોમાં એડવાન્સ ટેકનોલોજી વ્યક્તિઓ તરીકે જાણીતો છે. તેથી કર્મચારી ધરાવે છે. શહેરોમાં ઓલા જેવી અગ્રણી ટેક કંપનીઓ અનલોર્કિંગની અને વ્યવસાય સેન્ટર ખોલ્યો હતો જેનાથી માટે મનપસંદ સ્થળ બની ગયો (આશરે બે મહિના અનલોક પછી) સેનિટેશન અને પ્રઈવર ભાગીદારો ્વવસાય કરીથી સામાન્ય અને સવારી દ્વારા મહત્વ ઓલા ૧,૫૦૦થી વધુ પરિસ્થિતિમાં પહોંચી ગયો છે. પહેરવા સહિતના અનેક પગલાની ઈલેક્ટ્રિક અને વ્હિકલ સાથે જોડાણ છે. કરી શકાશે. પૂમે આઈટી ઇન્શ્રસ્ટ્રક્ચર અને ટેકક્ષેત્રના કુશળ એન્જિનીયરોની સાથે ૪,૦૦૦ ઇન્શ્રસ્ટ્રક્ચર અને ટેકક્ષેત્રના કુશળ એન્જિનીયરોની સાથે ૪,૦૦૦ સવારી દરમાિયન સલામતી જાહેરાત કરી છે. इंडियन बैंक \, 🗛 Indian Bank મેગા ઈ - હરાજી નોટીસ સામવાઇ સ્થાવર મિલકતોના વેચાણ માટે (જુઓ પ્રોવિસો નિચમ - ૮(૬)) ધી સિક્યોરીટાઈગ્રંથન એન્ડ રીકન્સ્ટ્રક્યન ઓફ ફાયતાબિયલ એવેટ્સ એન્ડ એન્ફોર્સનેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ને થોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સનેન્ટ) નિયમ) - ૨૦૦૨ના નિયમ - ૮(૬) ની જોગવાઈ સાથે વંચાલે લેતાં સ્થાવર સંપત્તિના ઇ - દરાજી વેચાલ નોટીસ

સિક જહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રીતે દેશદાર (રો) તેમ જ જમીનદાર (રો) ને ઓ નોટીસ આપવામાં આવે છે કે મીચે સ્થાવર સંપત્તિ કે જે સિકચોડે લેલાદારને નિરને રાખેલ/ ચાર્જ કરે? છે બને **J બિટ્ડબા બેઠ** (**Headi deuter**) માંચીકૃત નિધિકારી તારા **પ્રવાસ માંકોનિક કળતો વા**માં આવ્યો છે 'ને **કેમ છે જ્યાં છે અને છે કે તા** આપાસ" નીરે આપેલ તારીપ અહ્યાનાદ છે, મીને વિલ્યા કહેર લાદાર તેમ જમીનદારો પાસે લેવાની રામની વધુલાત પારે ટેવવામાં આવ્યો છે 'ને **કેમ છે જ્યાં છે અને છે કે તા** આપાસ" નીરે આપેલ તારીપ અહીં માંકે બોર બેલા કહેર લાદાર તેમ જમીનદારો પાસે લેવાની રામની વધુલાત પારેટ આપાના દોકાના તે છે બેન્યો છે તે અને હતા આપાસ" નીરે આપેલ તારીપ અહીં મીચે લેલ્લેમ કરવામાં અલે છે. ગીયેરી રામેલ અસ્કામતો આપેલા સમયમાં છે!કાયદા એગે કમજદાબેલું સાર્કેમાં એકટ, ૨૦૦૨ના સેક્શન ૧૩ના માન્ય ક્લે આવે છે.

ક્રમ ઉધ	ન દોરવામાં આવે શરકર્તાઓ / ૧ ગેંજરોનું નામ વ	લમીનદારો /	પ્રત્યક્ષ	ં / સાંકેતિક કબજો લેવાચેલ મિલકતોનું વર્શન	બાકી ૨કમ	અનામત કિંમત (રૂ.લાખમાં)	વધુ વિગતો તથા શરતો અને નિચમો માટે અધિકૃત અધિકારીનો સંપર્ક કરો	
1 અલ્ક સિક્ષ્ કરજા શ્રી ર ડાય શ્રીમ પંડ્ય શ્રીમ (જામ શાખ	ભામ સહેવા ઈન્વેરટી ગેવાન એન્દ્ર કુલાન તં.૧.૨.૩.૫.૫.૬. આ વિસ્તાર, 'ચા નિકેટ કુલા છે. કુલા છે. આ વિસ્તાર, 'ચા નિકેટ કુલા છે. આ વિસ્તાર, 'ચા નિકેટ અને બ્લેટ અને બ્લેટ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ આ વિસ્તાર, 'ચા નિકેટ અને બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બાબ બા			પ, ૬, પ્ર અને ૮, બીજો માળ, સેઝકળ ૧૫૦૫ જ ચો.ગી., હિં નિકોટન કોમ્પરેક્ષ' તરીકે જાણીની સ્ક્રીમ, જય મંગલ એ એ, જાનીન, ટી.પી.એસ: સ્ક્રીમ ન પ, ક્રા પ્રકાર્થવ્ય પ્લોટ ને, વાળવેત, મેરે (વી.પ). મેંચીપ, તા લુકો સી.કી. સ્ટ્રાસ્ટે વાલ – ૫ (ઓસડ), પુરલો અમરવાયા, રાજ્ય ગુજ્ય તેમાને ત્રેમ સ્ટા પ્લોટ સ્ક્રા ને કિ.સ. સાથે. ભિલ્કાનની ચતુર્શીમ ટે આ તે દુધાર મું ટ્રા કે અને દિસ્સા સાથે. ભિલ્કાનની ચતુર્શીમ પ્રાર્થે ટ્રા મતું દ્વારા માછીન ક્રા એટ. પ્રિટા સ્ટ્રા પ્રવાર આ તે દુધાર મું ટ્રા પ્રવાર આ તે ટી.પી. ટી.ડ, પ્ પશ્ચિમ :અન્ય બિલકત. (સોકોટેલક કલ્મને)	બેલ્ટ તા. નર્સ ૦૨.૦૧.૨૦૨૨૦ની ૩. ડીમાન્ડ નોટીસ શન મુજબ રૂા. જાગ મુજ રે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ. ક્રિમત અન્ય ખર્ચ.	(३.६१७७म) Rs. 8,581,000 .00	<mark>สันธ์ ดงไ</mark> <b>รป ดไรซ ฐาแร,</b> <b>ปโฐ ฟิจิพร 2</b> Ph: 079-27431248, Mob: 9929857725 E-mail: zoahmrecovery@in dianbank.co.in, zoahmedabad@indi anbank.co.in	
(કર૧ દ્વારા કિસન ગીરો! ચોકા અને ભગવ શ્રી વારસ ગાડી <b>શાખ</b>	ાં મીંગે કાળો 1 રાખરાર દેવકા દિવેદ (પૂરત કરી [કેમનાં મીપરા માંગે ગોહારામાં પુત્ર અને કાલુની વારસરાર, કરપરાર, ગામનિવાર અને ગોકોરતો, ગેમના એરલર ગાડીસના (માત્રા, સા, મી બાખતંતારે [કેસનોર્સર ગોરડીસના (માત્રા, પ્રારટ, સાને વારસરાર, કરપરા, ગામનિવાર અને ગોકોરતો )નેમના નેચરત પ્ર ગાડીસન (માત્રા) હારા, શ્રી લગવતો રહી કિસનારીસ ચોકાણ વારામાં, પુત્ર ભારકા પીંટર (છેનેસની)			સુવિધાઓ અને સમયવી, "ઉમંગ માં" તરીકે માણીતે ? આરોભા ઓવી ભેજનેતાલાક મુખ્યા પર પ્લાંકમા શા પવી ત્વં કુલ' સ, કેમ્બ્રલ ૨૦૦ મો.મી. (સર્ચ ન, ૧૫) પવી તે કુલ' સ, કેમ્બ્રલ ૨૦૦ મો.મી. (સર્ચ ન, ૧૫) માં ગોળ ગોળ સુવેર્ગ પ્લેલ્ડ માં ગુજરાતી પ્લોલના, ગુજ માં ગોળ ગોળ સુવેર્ગ પ્લેલ્ડ માં ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ કેમ્બ્રાલે પોલા પાલ અને મુન્દ્ર કે કિસ્તાલેથી ગોળ	/૧) ૧૯૯૨ ૧ ૧ <b>૦૮૯७૧૭ +</b> જે ૧ ૫ તે તારીખ સુધીનું દિવી વ્યાજ અને ખર્ચ, દાના કિંમત અને ચાર્જ	Rs. 1,020,000. 00	<b>ส์ ยินร รูพเว,</b> <b>ปรุ ห้อังว</b> Ph : 079-26620584 Mob: 9409602726 E-mail: br.sharda@allahaba dbank.in	
પ્રજા ગીરો કોદરુ શાખ	તી ભાવનાબેન ાપતિ (કરજ !કર્તા) ૨. શ્રી લાલપ્રજાપતિ(ક <b>ાઃ દિંમતનગર</b> (	હરેશકુમાર કરે દાર અન દિ હરેશકુમાર ચ કરજદાર) - કાં <b>ઈએબી</b> ) દાં		કુર રાકુર એપાર્ટમેન્ટ મેટલાપુરા, દિમેતનગર, તાલુકો - બસ્ટાકા, સેમકળ અંદાજે સુપર બિલ્ટ અપ વિસ્તાર પર.૩૭ સીચિ વર્ષ ન કર ગો (ને 07.3 તાલુકો - કિલ્પતનગર, ગુલ્લે શ્રીપ્રતી ભાવનાબેન દરેશકુમાર પ્રત્યપતિના નામની રહેશાંક માટ કરતો દિસ્સા સાથે, <b>ચતુસીમાં</b> પ્રયુડો - હેલેટ ન. બી-૧૦૨, ત્રીટી સર્વે ને. ૩૪. પ્રિલેમ પ્રેલેટ ને બી-૧૦૬, ત. બી-૧૦૪ ( <b>પ્રત્યક્ષ કબજો)</b>	તા. 0૨.05.૨0૧૮ની ડીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા. ૧૩,0૪,૩૪૬ +</b> જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ચ ખર્ચ.	Rs. 5,79,000.00	รูป จากรรรณยาง,           ขโร ฟิกิชร           Ph: 079-27431248           Mob : 7718977497           Frank:           zoahmetowery@indian           bank.com,           zoahmetabad@indianba nk.com	
અને: શ્રી (કરશ્ શ્રીઅ શ્રીમત (જામ શ્રી િ સલીઃ	બી ફિરોઝ મોરામભાઈ પરાશ (કરપટા પડોટ, સ. ૧૪/, બંધાકામ, એન.ગેરે અને ગેરેકાન) બી સલીબભાઈ મોરામદભાઈ પરાશ (કરપટાસ અને ગેરેકાન) બી અકસરા સરકાબઈ પરાશ (જાગીનદાર) બી બારે સપીના પરાશ (જાગીનદાર) બી બારે સપીના પરાશ (જાગીનદાર) બી બારે સપીના પરાશ (જાગીનદાર) બી સ્ટેરે બોરામદભાઈ પરાશ સ્ત્રે બી બી ફિરોઝ મોરામદભાઈ પરાશ સ્ત્રે બી			૪/ ડી, સેકલા વિસ્તાર ૧૧.૮૦ થો.મી. અને ત્યારબાર હ.એ. જમીન, સીટી સર્વે વોર્ડ નં. ૬, ઘોઘા રો, કંસારા ના હ.એ. જમી સાંચે વ્યક્ત પુરાવતાં આવેલી સી ફિરોઝ પરમાર અને શ્રી સરીનાબાઈ મોહમરા નાપી પરમાહના માંચી <b>શતુર્ધીમાં આ મુજબ</b> ા ઉત્તર : પ્લોટ નં. ૧૧૪-ઈ, ટ્રટ સિંહા રોડ, પૂર્વ : પ્લોટ નં. ૧૧૪-એ, પાંચિમ : પ્લોટ	તા. ૨૨.૦૧.૨૦૨૦ની કીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા. ૧૪૫૭</b> ૬૮૬ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 1,616,000	<mark>ส์) จายังเ ดาะเขย: 2ชร, ปรุ ฟิจชะ</mark> Ph: 02822-222221 / 223221 Mol: 8318037498 E-mail: morvi@indianbank.co .in	
5 શ્રી મોઠન (કર ગીરો: શાખ શાપ	થામાં કાયાલનગર બી કરમુખાર્થી દેરે તું ડુ: ૨૦, ૨૦, ૯૫, ભીમ માગ, સેમ્ડ્ર મોકલનાથી પરમાર સંગ્રેલિના) થામાં : ૧૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨			ત્રકળ પ્રચ્ચ પ્રચ્ચ થો.ગી., બિલ્ટ અપ વિસ્તાર તેની સાથે ર ૧. ૪૯ ચો.ગી. સાથે કોમન તુવિધાઓ અને સગવડો, પ્રા.ગા-સ. (શ્રે-અંગિલાક જનીમ પર પ્રચંચાક્ર મરેશ, પ્રો.ગી., શાંઇનલ પ્લોટ તેનું ૨૨,, કેમકળ ૧૩૮૯ ચો.ગી. કેમકળ ૧૨૧૮ વો.ગી., ટાઇલ પ્લાંગી જ્યાં કામે તે. ૧૦૬ કો વટલા અને ગુસ્ટલો અમદાલાદ, રણુટ્રેશન સબ- ગુસ્ટા પૂરાતમાં આવેલી શ્રી હસ્પુત્રભાવી ગેનેકલાઈ પરમાગતા રહેતા તવામ હઠ અને હિસ્સા સાથે, <b>વિહાતની ચતુર્સીમા</b> એચ/ ૨૦૩, દ્વીષા: ભાગ-સ, ક્ષેટ તે. જી/ ૨૦૬, પૂર્વ : ૪ (સોકોઉકડવર્ખ) (સ્ટાર્ક્સ)	તા. ૦૨.૦૧. ૨૦૨૦ની ડીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા. ૮૩૫૭૮૮ +</b> જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમ્લ અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 1,518,000. 00	<mark>จิปิโยษร ฐพเจ, ปโร ไจด้จะ</mark> Ph: 079-26620584 Mob: 9409602726 E-mail: br.sharda@allahabad barik.in .zoahmrecovery@in dianbank.co.in	
(પ્રોપ શ્રી (પ્રોગ જામી શ્રી (જામ	ઇન્ફોમેડ ટેક એન્ડ માર્કેટીંગ ઓક્રીસ તં.૧૩, બીજો (પ્રોપરાથશ્યીપ થર્મ, ક્રજ્પદાર) બી કિમાંચુ અભિકૃષ્ધ ઘુકલા (પ્રોપરાથટર, ગીરોકર્તા અને જામીનદાર) શ્રી મનો દેરસિંઘ રાજ પુત			જો માળ, સેત્રકળ ૨૪૦ ચો.મી., દિપાલલી સેન્ટર તરીકે મબ પરોટ નં, ૪, કાઈલલ પરોટ નં, ૧૫૪, ટાઉન પ્લાનિંગ ગોસપુર સીમ, ગુસ્પત હાઈ કોઈનો માંગે, એલીસલીજ, પુજરાતમાં આવેલી શ્રી બિશું અનિકદય શુકલાના નામની ના તમાગ ઠક અને હિસ્સા સાથે, મિલકતનો ચતુસીમાં આ જ, દક્ષિણ સાગ્યું અને ત્યારભાદ ખુલ્લી જગ્યા, પૂર્વ કોમન દિવાલ, પશ્ચિમ ઓફીસ નં, ૧૪ અને કોમન દિવાલ	તા. ૦૧.૧૨.૨૦૧૮ની ડીમાન્ડ નોટીસ મુજબ રૂા.૩૦,૨૮,૨૪૮.૦૦ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 20,40,000. 00	<mark>ଶ୍ଚી କୀଟବ કુમાર, ଧ୍ୱାର୍ହ મેબેજર</mark> Ph: 079-27431248 Mob: 9929857725 E-mail: zoahmrecovery@indi anbank.co.in, zoahmedabad@india nbank.co.in	
ફર્મ, ક શ્રી (પ્રોપ શ્રી ઉ શ્રી વિ	જય મોગી પ્લાસ્ટીક (પ્રોપરાયટરશી) કર્મ, કરપ્લાર) બ્રી વિકુલ ભાઈ કે વછા શી (પ્રોપરાયટર અને ગીરોકતી) બ્રી ઉપેશ ગોંડાથી (જામીલાર) બ્રી ઉપેશ ગોંડાથી (જામીલાર) બ્રી ઉપેશ ગોંડાથી (જામીલાર)		ય <b>તુ</b> સામાં આ મુજબ પૂર્વ : ફ્લેટ નં. એચ-	કળ ૮૦ ચો.ચાર્કસ (૬૧.૮૮ ચો.મી. સુપર બિસ્ટ અપ ગેચ, "દ ભોજવામ કો-ઓપરેટીત કાઉકૉંગ સોમાચટી ટીતી રકીમ, સર્ચ તે હર, છે.પી૧૯, કાઇનંલ પ્લોટ મ નિકોલ, સબ જીલ્લો થી બિલ્લુભાઈ કે લાગદીના નામની પંહલત તેવા તમામ ઠક અને વિસ્ટા માટે લાગદીના નામની પંહલત તેવા તમામ ઠક અને વિસ્ટા માટે, <b>બિલકતની</b> ૧ : ઉત્તર: કોમને પેસેજ, દ્વિશિટ : ક્લેટ નં. એચ-૪૦૫, ૪૦૧, પશ્ચિમ : કોમને પેસેજ <b>(સોકીતક કબ્મે)</b>	તા. ૩૦.૦૧.૨૦૨૦ની ડીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા.૧૬,૭૪,૯૦૯.૦૦</b> + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 16,00,000. 00	श्री नीटफ डुमार, रीइ मेनेफर Ph: 079-27431248 Mob: 9929857725 E-mail: zoahmrecovery@indi anbank.co.in, zoahmedbad@india nbank.co.in	
ર અને	શ્રીમતી કરીશ્મા રાષ્ટ્ર જાદવ (કરજદાર ક્લેટ નં. ઈ/ ૩૫, પઠેલો અને ગીરોકતી) કોર્પોરેશન રેકોર્ડ મુજબ શ્રી રાષ્ટ્ર જાદવ (સદ્- કરૂજદાર) ''ગોકુલદામ એપ્રાર્ટમેવ્ટ		લ્લેટ નં. ઈ∕.૩૫, પાં કોર્પોરેશન રેકોર્ક મુ ''ગોકુલઘામ એપારે ઓપરેટીવ ઠાઉસીંગ પ્લોટ નં.૧૯૬ પૈકી શાળવેલ) ટાઉન પ્લ અમદાવાદ અને રહ્ ગુજરાતમાં આવેલી રહેણાંક મિલકત તેન <b>મુજબ</b> ઃ ઉત્તર : સોર પશ્ચિમ : ક્લેટ નં. ઈ	(લો મળ, વિત્સાર કેરલક પટ, છપ ચો.ગી. (ચૂનિસીપર) ખેરું તેલી સાથે સામાવ્યા સુવિધાએ એક સરપરી, ખેરું તે લોક માછીની શ્રેષી, ના દાર્ઘર ભવાની શે- કોસાથી વિ., લાંચાય શ્રેરો અંતે સાણે વેપ્રત્યા, પ્રત્યાને (શર્વ સ. ૩૯, ૧+ ૨+ ૩ અને કુલ, ૧ / ૧+ ૨) લાંચાર વિંગ ક્લીએ સ. 1, થી જે અને લાણી વેપ્રત્યા, જુરાતી બેરીના કેશીએ શ. 1, થી જે અને લાણી વેપ્રત્યા, જુરાતી બેરીના કેશીએ શ. 1, થારતના નાખી અરોપાર્ટના શે બેર કારતા અને વિંદ્રાના સાથે. <b>વિદ્યાડતની ચતુર્થીના આ</b> કાલ્યી રોડ, દર્શિણ : સવીરત કેડ, પૂર્વ : હરેટ નં. ઇ- ૩, 3 ( <b>સોટો સડબ પ્ર</b> )	તા. ૦૨.૦૩.૨૦૨૦ની ડીમાન્ડ નોટીસ મુજબ રૂા.૯,૪૭,૮૮૬.૦૦ + જે તે તારીપ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 1,340,000. 00	<mark>કી છુતેન્દ્ર કસવાન, ચીક મેનેજર</mark> Ph: 079-27431248 Mob: 7718977497 E-mail: zoahmrecovery@india nbank.co.in, zoahmedabad@india	
(કર૧ ક્રીમત (કર૧ શાખ	શ્રી કેતનકુમાર મણીભાઈ પંચાલ (સ્ટપ્ટાર અને ગીરોકતો) શ્રીમાંતી પ્રજ્યને કેન્સનુમાર પંચાલ (સુવોધ્યાએ અને સગલ્ડ) (સ્ટપ્ટાર અને ગીરોકતો) શાખા સાફ્રીબાગ (ઈએબી) થાખા સાફ્રીબાગ (ઈએબી) સ્ટ્રેજરેરાન સબ જીરતો છે. કેટ્ટ્રન્ટરાન સબ જીરતો છે. કેટ્ટ્રન્ટરાન સબ જીરતો છે.		સુવિધાઓ અને સગ બાંધકામ થયેલ બિન ના બદલે ફાળવેલ), રજીસ્ટ્રેશન સબ જીલ ગુજરાતમાં આવેલી કેતનકુમાર પંચાલન મિલકતની ચતુર્સી એલ/૧૦૧, પૂર્વ : ફ	પહેલો માળ, સેનકળ સુપર બિલ્ટ અપ વિત્તાર ૯ ક, પ્પ બેલિળાજુ તમાન્કો જીવિલ પડડા એ ગો., સામાન્સ વાલ્યો, સ્થાનિલાયઘા કે કેટલ-1 તરીકે જાણીતી કરીમ, બીલાયક ગેની, કારાંબલ પોટાં, કર ( ચલે તે કર) ( ડી.પી. સીમ અંદ, ગો. ગોને ચાંદલોકીયા, તાલુકો સાબરમાંત, કો અલ્પાદા - ડ. ( ચાંદા) અને પ્રેડીનો ડી પ્રાન્ચે શ્રી કેતલકુશાર મધીકાઈ પંચાય અને શ્રીની પુગ્લનેક બાનની બિલક તે વા તમાન ૪૭ અને હિંસ્સાં સાથે, કાં એ સુખરા કંઈસ: ગાનુંહોલા કબ્લો	તા. ૧૦.૦૨.૨૦૨૦ની ડીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા.૨७૧૨૦૧૯.૦૦</b> + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને યાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 3,100,000. 00	<mark>ສິງ ຫຼວດອະ ອະເບເຫ, </mark>	
(પ્રો) ફર્મ, હ બાબ (પ્રો જામી ગીરો: શ્રી ગુગ્નર શાખ (ઈએ	0 મિક્સ એક્સ્ટપ્રમાર્ક્ત મિક્સ ૧૧ - કરોટનં તી પર, પરેલે માન્ય, પ્ (પો પ્રસ્થાર દર્શાય) કરી, કુસ્ટરાટ) બાં તુ સ્વર પ્રાપ્ત્ર બાં કરો સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ્વર પ્રાપ્ત્ર બાં સ સ્વર પ્રાપ્ત્ર બાં સ સ બાં સ બા સ બા		પ્ર'મો જમીન નો અવિભાગુ !પી પર, કાઈનલ પ્લોટ નં ! આવેલી શ્રી વિજયકુમ દેરસા સાથે. મિલકતની ચ . પૂર્વ : સબ પ્લોટ નં. શ્ર . પૂર્વ : સબ પ્લોટ નં. શ્ર . પૂર્વ : સ્ટમ ગ્રે જોટ . . શ્ર ગુજરાતમાં આવેલી ! મામ હક અને ફિસ્સા સાથે. 1ય અને ૧૭. પૂર્વ : સબ પ	માળ, પાંકવ એપાર્ટમેન્ટ, સેઝફળ ૫૧.હર ચો.મી., બિદર અપ માવિભાજીત પ્રમાણાનો ભાગ, રેત્મનુ સર્વે નં ૨૧, ૨૭, ૨૭ હા વડો ટનં .co' પળ, મોંગે દોાકાર, મળ જુદલો અને જુદ્ધો ની વિગયવુમાર બાબુલાલ ગજરાઓ નામની અચલિત રહેશાંક મિલહતની ચતુવીમાં આ મુજબ આ આપ્યા રે ઉત્તર રોક, દક્ષિણ લોટનં.૨૧, પશ્ચિમ : સબ પ્લોટનં ૨૨ (પ્ર <b>ત્યક્ષ કબનો</b> )	તા. ૩૦.૦૧.૨૦૧૯ની ડીમાન્ક નોદીસ મુજબ રૂા.૬૧,૬૬,૮૫૭.૦૦ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Property -1 Rs. 20,10,000. 00 Property - 2 Rs. 20,72,000. 00	ร์ได้ไรซ ฐษแร, 21g ปิจำระ       Ph: 079-27431248       Mob: 9929857725       E-mail:       zoahnmecovery@india anbank.co.in,       zoahmedabad@india nbank.co.in	
(કર૧ ૨) ક ઝાલ મહાવ અને 3)કુ શાખ	જાણીતો ક્લોમ, ગુજરાત 605 ૨) શ્રી મહાવીરસિંક ગંભીરસિંક સંગળ (પ્રો પરાયટર મેસર્સ નં, ૧૫૭, ૧૫૯, એ.એ.સ.), અંગ શિકેલો, ૧૫૯૫, ૧૫૯, ગેય. અંગે શિકેલો, ગંભાનીટસંક આ શાન્ના માણીનગર (છેએ)				તા. ૨૮.૧૧.૨૦૧૭ની ડીમાન્ડ નોટીસ મુજબ રૂા.૬૮૮७૩૩૨.૦૦ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 1,648,000	ส์ไ ค์ไรซ ฐพเร, ปโร ฟิจิพร           Ph: 079-27431248           Mob: 9929857725           E-mail:           zoahmrecovery@indiank.co.in,           zoahmedabad@indianbank.co.in	
શ્રીમત પટેલ શાખ	ા સંશુભ રિ પરાચટરશીપ કર્મ, તી ચંદ્રિકાબેન ન (કરજદાર/અર ના : વસ્ત્રાલ	રાજેશભાઈ અં ૪દાર) શ્રં સ ર (	ગા, વટવા-લાંભા કેનાલ મદાવાદ, ક્ષેત્રકળ અંદ મિતી ચંદ્રિકાબેન રાજેશ ાથે. <b>મિલકતની ચતુસી</b> ૦૪, પૂર્વ : બ્લોક નં. એ ' <b>પ્રત્યક્ષ કબજો)</b>	તં. ઓ, રભર (બીજો માળ), હાતા ટર્બિંગ બી પણે, ભુગ્મરિયા ડેઠ, તારોલ- ટરસ્ટપ્ર તા. અમરાબાદ ગારી (પૂરો), ગુરૂલો જે સુપર બિલ્ટ અપ વિસ્તાર પછ.શ્વ ચો.પ્રી માં આવેલી ભાઇ પેટેલ્સા લામલી મિલકત તેલા તમામ હક અને ફિસ્સા <b>માં આજુપલ</b> કંતરા હતોક નં. એન. દશિણ ક્ સરેટ નં. ઓ- ા, પશ્ચિમ ક્ સરેટ નં. એ-૨૦૨.	તા. 0૮.0૧.૨૦૧૯ની ડીમાન્ડ નોટીસ મુજબ <b>રૂા. ૧૬ ર૨૬૦૦.૫૩</b> + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ.	Rs. 1,080,000	<mark>શ્રી નીરજ કુમાર, ચીફ મેનેજર</mark> Ph: 079-27431248 Mob: 9929857725 E-mail: zoahmrecovery@indi anbank.co.in zoahmedabad@india nbank.co.in	
ઈએમડી ર તા. ૧૮.૧ E-Aucti Betwee extensio	૧૧.૨૦૨૦, સાં ion Date :- : en 11.00 A.M on. Bid Incr તી તેમજ શરતો ર	ાની છેક્કી તારીપ જે ૪.૦૦ વાગ્યા On 20.11. A. to 1.00 P.? emental Val અને નિયમો ડાઉ	મ અને સમય :– સુધી 2020 A with unlimited ue is Rs 10,000, નલોડ કરવા માટે જુએ	: : I. https://www.indianbank.in, II. https://www.mst	cecommerce.com, III. ht	tps://www.ibapi.in		
નોંધ : આ નોટિસ લગ્પરાર/જમીનદારો/ગીરોદારને ઉપરોક્ત લોન માટે ઉપરોક્ત નાદીને અને દાવિલ વિનતો સાથે રાખેલ વેધાણ મોટની પણ છે. તારીય : ૧૯.૧૦.૨૦૨૦, ચમદાવાદ શ્રી/- આધિકૃત અધિકારી, અલ્ફાબાદ લેંક								

**પીટીઆઈ** ૧,૦૦૦થી વધુ એન્જિનીયરોની વ્યવસાયના સ્થાનિક સોલ્યુશન્સ હતું કે, પૂણે ખાતેની સુવિધા આ નવી દિલ્હી, તા. ૧૮ ભરતી કરવામાં આવશે, તેમ પૂરા પાડવામાં આવશે. ઓલાના ત્રિમાસિકગાળાના અંત સુધીમાં રાઈટ હલિંગ પ્લેટફોર્મ સૂવોએ જણાવ્યું હતું. આ અંગે પ્રવક્તા સાથે સંપર્ક કરવામાં આવ્યો કામગીરી ઘરૂ થઈ શકે છે જેથી ઓલાએ પૂણે ખાતે નવા ટેકનોલોજી સૂવોએ જણાવ્યું હતું. બેંગ્લુરૂ પછી હતો પરંતુ આ અંગે વધુ માહિતી આગામી ત્રણ મહિનાઓમાં સેન્ટરની સ્થાપના કરી છે અને પૂછેમાં કંપનીના બીજો ટેક સેન્ટર આપવાનો ઈનકાર કર્યોછે આઅંગે ૧,૦૦૦ સિકેલ્ડ ટેકનોલોજી આગામી થોય વર્ષોમાં ત્રે અને આ બાલ માં છે અને પણ સ્થાન સાથે બાલ બાલ ગામ ગામ ગામ કરી છે અને પૂછે હવે છે ગામ પ્રાય માહિતી ધરાવતા વ્યક્તિએ જણાવ્યું પ્રફેશન્સ માટે રોજગારીનું સર્જન

વર્ષોમાં હેશે, અને ઓલા ગ્રૂપના તમામ Garden Reach Shipbuilders & Engineers Limited Reference 3046 Generation Solidation (2012) Tel (03) 2469-8245 Fact (03) 2469-8450 Webbie www.greait. Factilitinestor.greivance@grea.co.in (Chr. L35111WB1934G0007891) Tel: 011- 41659500, 41595100, 46484200, Fax: 011-41659144 E-mail: info@ptcindia.com, Website: www.ptcindia.com NOTICE NOTICE Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, NOTICE: hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Morday, the 9th day of November 2020 inter-ails, or consider and approve the un-audited standalone and consolidated financial results for the quarter ended September 30, 2020 amongst other items mentioned in the agenda. lation 29 of the SEBI (Listing Pursuant to Regulation 47 read with Regulation 29 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is been with the set of the location of the set of the set of the set of the set of the constant of the quarter and half year ended 30<sup>th</sup> September, 2020. Further, in terms of the Company's 'Code of Conduct for Prevention of Insider Trading and Fair disclosure of Unpublished Price Sensitive Indication and SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, Insider Trading and Fair disclosure of Unpublished Price Sensitive Information and SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, the sensitive and Hair Trading Window for dealing in securities of the Company's Valid the Trading Window for dealing in securities of the Company's Anal Irranian Osada (Company's Code of the Company shall remain closed from 1<sup>10</sup> Code 2020 to 13<sup>th</sup> November, 2020. The Trading Window for dealing in securities of the Company shall remain locaded from 1<sup>40</sup> October, 2020 to 13<sup>th</sup> November, 2020. The said notice may be accessed on the Company's webite at the said notice may be accessed on the Company's webite at the said notice may be accessed on the Company's webite at the said notice of the securities of the secu ursuant to Regulation 47 re By order of the Board For PTC India Ltd. Sd/ Sd/-(Rajiv Maheshwari) Company Secretary FCS- 4998 ccessed at the link of the Exchanges' in Statutory uncidid com and RSE r details on the matters above said may be accessed at the link of the website <u>http://www.ptcindia.com</u>, (Notice to Exchanges' in Statutor and Stock Exchange website i.e.NSE: <u>www.nseindia.com</u> and BSE remain closed from 1\* October, 2020 to 13\* Rovemuer, 2020. The said notice may be accessed on the Company's website al www.grse.in and on the websites of the Stock Exchanges al www.nseindia.com and www.bseindia.com For Garden Reach Shipbuilders & Engineers Limited ext. રાટા કેડિટલ હાઉસિંગ કારળાન્સ લીમીટેડ. સ્ટ્રાસ્ટ ઓકીસ : ૧૧મો મળ, ટાવર એ, પેલન્સુલા નિળનેસ પાર્ક, ગાયતસ્ય કરમ માત્રે, લોક્ષર પેલે, મુંબલ - ૨૦૦૦ નર, CIN: US7190MH220BPC:187582. સંપર્ક ને (case) ૧૯૮૩૧૧૮ ન ૧૯૮૩) વાદર કરમ Sandeep Mah Company Secretary and Compliance Place: Kolkata Date: 16<sup>th</sup> Oct, 2020 5 Shrenik 🚥 શ્રેણિક લીમીટેડ CIN - L51396GJ2012PLC07306 ા૦૫–૫૦૮, ટેન–૧૧, મ૨ડીસા પ્લાઝાન নাগৰ। ২০০২-২০২১ ১৯৮-৭৭, মহটাৱা যোগোৰী আকুৰ্মা, হাী.প্ৰা.কী.১, ৩৫, গুবহাৰে ইণ্ডী : (০৩৫) ২হ য়হত ১০৫-০ খণ্ড ইণ্ডীক্টকা: (০৩৫) ২হ য়ত ৫,৫৭ শীৱৰ: <u>www.shrenik.co.in</u>, **বৈষোগ্য : ্ৰেঞ্জ**ভাদলেট কে লৈ નોંદાગી સર્ચાલય તમાના પ્રાપ્યક કાર્સન અની માંચ જણાવલા મિલાકનનો કળવે લાકળીઓ છે. આ દાકળે કે વેસારાં એક એપ દેશ બનાત મિલાકા સાથે ગોટાં ન કરવા સાચ્યા કરવામાં આ રે છે અને વિલાક સાથેન પ્રાપ્યકા સોટો ટાટા કોપ્ટિસ લાઈસિંગ સાવના નલી પીટેટલી ની વે જણાવેલા દામ તેમજ તેના પરના લાજ અને માંગણ પોટેસના લોટમળી મેચલા પ્રાપ્ય કે, સેટ કરેને આવીના રહેશાં. સંસર્ધો કે એપટ પારને મેચલવા માટે ચેક્ટની કલગ ૧૩ ની પેટા કલગ ૮ની વોગવાછનો પ્રાને દેવાદા દેવું થાખ દેવવા અને ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા થતાં ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમચગાળાનું અનઓડિટ નાણાંકીચ પરિણામોના તારણનું પત્રક ાપ્ય લાચ્ચ્યર, ૨૦૨૦ દેવની સપ્રેચ્ચર, ૨૦૨૦ વા સેષ્પુસ આ વિચાસિય સેષ્પુસ આ સિચીક્ર યા સે પ્રેચ્ચર, ૨૦૨૦ ૧ લ સ્પુર આ વિચાસિય સેષ્પુસ આ સિચીક્ર યા સે પ્રાટ્ય ૧ લ દ્વા ૬,૦૬ ૨ સ્પર ૧,૧૩ ૨ સર ૧,૮૦ ૨ સ્પર ૧,૨૦ ะ เมริงเป็น ະເພີຍ ແລະ (કરવેશ, અપવાદરુપ અને/કે અસાધારણ બાબતો પં સમયગાળા દરમિયાન ચોખ્બો નફો / (નુકસાન કરવેરા પહેલાં (અપવાદરુપ અને/કે અસાધારણ બાળતો સમયગાળા દરમિયાન કરવેરા પછીનો ચોખ્બો 366.68

૯૩૬૯૩૯૫ ાક્યોર્ડ એરે ... આરંશા ( ૨૦૫ સો.સાર્ડ ૨ ૧લેં નં. ૮૫ <sup>૭૧ જ</sup> ત્વરવા. : સુ., પશ્ચિમ : ગાર્ડન, ઉત્તર : બંગલો નં. ૯૯ એસ.. કબિલ્લ - ગેવ અધિકૃત અધિકારી બ્લાન્સ લીમીટેડ વતી તારીખ : ૧૭–૧૦–૨૦૨૦ ટાટા સેપ્રિટલ હાદસિંગ સ

કળજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

## ReLI∡NCe Reliance Communications Limited website:www.rcom.co.in

Registered Office: H Block, 1st Floor, Dhirubhai Ambani Knowledge City, Navi

Mumbai - 400 710

CIN: L45309MH2004PLC147531

SI.	Particulars	uarter ended		Year ended	
No.		June 30, 2020	March 31, 2020	June 30, 2019	March 31 2020
1	Total Income from Operations (net)	215	300	866	1,734
2	Net Profit/ (Loss) for the period (before tax, Exceptional and/ or Extra Ordinary Items)	(76)	(129)	(201)	(579)
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/ or Extra Ordinary Items)	(76)	(129)	(201)	(10,793)
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/ or Extra Ordinary Items)	(81)	(131)	(206)	(10,807)
5	Profit/ (Loss) after Tax from Discontinued Operations	(1,328)	(1,413)	(160)	(31,870)
6	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(1,404)	(1,587)	(358)	(42,702)
7	Equity Share Capital (Equity Share of Rs. 5 each)	1,383	1,383	1,383	1,383
8	Earnings Per Share (of Rs. 5/- each) (Basic and Diluted) - Rs. (Before exceptional Items)				
	(a) Continuing Operations	(0.30)	(0.48)	(0.75)	(2.16)
	(b) Discontinued Operations	(0.76)	(0.51)	(0.58)	(3.74)
	(c) Continuing and Discontinued Operations	(1.06)	(0.99)	(1.33)	(5.90)
	(After exceptional Items)				
	(a) Continuing Operations	(0.30)	(0.48)	(0.75)	(39.38)
	(b) Discontinued Operations	(4.83)	(5.17)	(0.58)	(116.11)
	(c) Continuing and Discontinued Operations *Not annualised for Quarter	(5.12)	(5.65)	(1.33)	(155.49)

	SI.	Particulars	Q	Year ended		
	No.		June 30,	March 31,	June 30,	March 31,
			2020	2020	2019	2020
1	1	Tumover	141	156	236	818
Ш	2	Profit /(Loss) before tax	(90)	(1,254)	(107)	(16,863)
	3	Profit /(Loss) after tax	(90)	(1,254)	(107)	(16,863)
	4	Profit / (Loss) after tax from Discontinued Operations	(1,111)	(1,275)	(92)	(28,475)

III. The Consolidated Financial Results of the Company have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013. IV. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33

of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the Company, www.bseindia.com , www.nseindia.com and www.rcom.co.in. (Reliance Communications Limited is under corporate insolvency resolution process pursuant to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. With effect from June 28, 2019, its affairs, business and assets are being managed by, and the powers of the board of directors are vested in, the Resolution Professional, Mr. Anish Nanavaty, appointed by Honble National Company Law Tribunal, Mumbai Bench, vide order dated June 21, 2019 which was published on the website of the Honble National Company Law Tribunal, Mumbai Bench, vide order dated June 21, 2019 which was published on the website of the Honble National Company Law Tribunal, Mumbai Bench on June 28, 2019.) Place: Mumbai

Date: October 17, 2020

કસાન)(અપવાદરુપ અને(કે અ સ્યગાળા દરમિયાનની કુલ 322.99 સમયગાળા દરદેમચાનની કુલ સમાવ (કરવેરા બાદનો નફ્ર્ય,(નુકસાન) સહિ સમાવેશક આવક (કરવેરા બાદની) ઇક્વીટી શેર મૂરી શેરદીઠ આવક (દરેક રુ. રનો)(લા બંધ કરાયેલ કામગીરી અંગે) . બેઝીક 0.92 0.92 0.30 0.30 ૨. શિભ્યુટેડઃ 

**બોર્ડ ઓફ ડાચરેક્ટર્સ** વતી ક્ષેણિક વિમાવાલા

ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી